



NZ-7865

Seat No. _____

Third Year B. Com. (Non CBCS) Examination

February – 2017

Accounting & Finance - III

Time : 3 Hours]

[Total Marks : 100

- ૧ શ્રી સોમનાથ છુટક વેપારી તરીકે ધંધો કરે છે. હિસાબના વ્યવસ્થિત ચોપડા તે રાખતો નથી. તેણે કરેલા રોકડ વેચાણમાંથી તે ધંધાના અને બીજા ખર્ચા ચૂકવે છે. હાથ પર હંમેશાં ૨૦૦૦ રોકડ રાખે છે. બાકી રકમ બેંક ખાતામાં ભરી દે છે. તા ૩૦-૬-૨૦૦૩ના રોજ પૂરા થતા વર્ષના સ્ટોકના પત્રકો ખોવાઈ ગયાં છે. તેમને જણાવે છે કે તેણે પડતર કિંમત પર ૩૩ $\frac{1}{3}$ % નફો મળે એવી રીતે જ હંમેશાં માલ વેચે છે. નીચે આપેલી વધારાની માહિતી પરથી તા. ૩૦-૬-૨૦૦૩ના રોજ પૂરા થતા વર્ષના જરૂરી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

મિલકત અને દેવાં	૧-૭-૨૦૦૪	૩૦-૬-૨૦૦૫
રોકડ સિલક	૨,૦૦૦	૨,૦૦૦
લેણદારો	૧૨,૦૦૦	૨૭,૦૦૦
બેંકમાં સિલક	માહિતી નથી	૨૪,૦૦૦
દેવાદારો	૩૦,૦૦૦	૧,૦૫,૦૦૦
માલનો સ્ટોક	૮૪,૦૦૦	માહિતી નથી

બેંક પાસબુકમાંથી નીચેની માહિતી મળે છે :

લેણદારને ચૂકવ્યા ૨,૧૦,૦૦૦

ધંધાના ખર્ચના ચૂકવ્યા ૩૬,૦૦૦

૧-૧-૦૫ના રોજ ૧૦%ના દરે લોન ૩૦,૦૦૦

બેંકમાં રોકડા ભર્યા ૩૦,૦૦૦

દેવાદાર પાસેથી મળ્યા ૨,૨૫,૦૦૦

આ ઉપરાંત તેણે માલ માટેના લેણદારને ૬,૦૦૦ રોકડા ચૂકવ્યા અને પગારના ૧૨,૦૦૦ રોકડા ચૂકવ્યા હતા. તેણે અંગત ઉપયોગ માટે ૨૪,૦૦૦ રોકડા ઉપાડ્યા હતા.

અથવા

- ૧ ભારતીય કંપની ધારાની કલમ ૨૧૨ મુજબનું હિસાબ સાથે જોડવાનું પત્રક તૈયાર કરો.

- ૨ શ્રી વિપુલ પાસે તા. ૧-૧-૨૦૦૩ના રોજ ૧,૫૦,૦૦૦ની ૧૨%ની સરકારી જામીનગીરીઓ હતી. જેની ચોપડે કિંમત ૧,૪૪,૦૦૦ હતી. આ જામીનગીરી ઉપર દર વર્ષે ૩૧-૩ અને ૩૦-૯ના રોજ વ્યાજ ચૂકવાય છે. ખરીદ વેચાણના દરેક વ્યવહાર પર ૧% લેખે દલાલી દાર્શનિક કિંમત પર ગણવામાં આવે છે.

તારીખ	દાર્શનિક કિંમત	ભાવ	નોંધ
૧-૪-૨૦૦૩	૮૦,૦૦૦	૮૮	વ્યાજ સહિત ખરીદી
૩૧-૫-૨૦૦૩	૬૦,૦૦૦	૧૦૧	વ્યાજ સહિત વેચાણ
૧-૬-૨૦૦૩	૪૦,૦૦૦	૮૬	વ્યાજ બાદ વેચાણ
૩૦-૧૧-૨૦૦૩	૨૦,૦૦૦	૮૮	વ્યાજ સહિત ખરીદી

સ્ટોકનું મૂલ્યાંકન LIFO પદ્ધતિ મુજબ ગણવામાં આવે છે. તમે વર્ષ ૨૦૦૩ માટે શ્રી વિપુલના ચોપડામાં ૧૨%ની સરકારી જામીનગીરીનું ખાતું તૈયાર કરો.

અથવા

- ૨ દીપ લિ.નું પાકું સરવૈયું નીચે મુજબ છે :

૩૧-૩-૨૦૧૧ના રોજનું પાકું સરવૈયું

દેવાં	રકમ	મિલકતો	રકમ
ઈ. શેર દરેક ૧૦ના	૧,૮૦,૦૦૦	પાઘડી	૧૦,૦૦૦
અનામત અને વધારો	૨૦,૦૦૦	પ્લાન્ટ	૧,૨૦,૦૦૦
લેણદારો	૫૦,૦૦૦	ફર્નિચર	૫,૦૦૦
દેવીહૂંડી	૨૦,૦૦૦	સ્ટોક	૮૦,૦૦૦
ચૂ. બાકી ખર્ચા	૫,૦૦૦	દેવાદારો	૪૦,૦૦૦
		અગાઉથી ચૂ. ખર્ચા	૩,૦૦૦
		રોકડ અને બેંક	૧૭,૦૦૦
	૨,૭૫,૦૦૦		૨,૭૫,૦૦૦

મિલકતોની નીચે મુજબ કિંમત નક્કી કરેલ છે :

પ્લાન્ટ..... ૧,૧૦,૦૦૦

સ્ટોક..... ૮૭,૦૦૦

ફર્નિચર ૬,૦૦૦

દેવાદારો ૩૬,૦૦૦

છેલ્લા ૩ વર્ષનો નફો ૩૦,૦૦૦, ૩૧,૦૦૦ અને ૩૩,૦૦૦

રોકાયેલ મૂડી પર વળતર દર ૧૦%

છેલ્લા ૩ વર્ષની ભારિત સરેરાશના આધારે પાઘડીની કિંમત નક્કી કરો.

૩ ક્રિબ્ના લિ.નું તા. ૩૧-૩-૨૦૧૧ના રોજનું પાકું સરવૈયું

દેવાં	રકમ	મિલકતો	રકમ
૧૦%ની પ્રેફ. શેરમૂડી		પાઘડી	૩૦,૪૦૦
૧૦ની એક એવી		જમીન-મકાન ૫,૪૦,૦૦૦	
૪૦,૦૦૦	૪,૦૦,૦૦૦	– ઘસારો ૨૦,૦૦૦	૫,૨૦,૦૦૦
ઈ. શેર દરેક		મશીનરી ૫,૦૦,૦૦૦	
૧૦નો ૪૦,૦૦૦	૪,૦૦,૦૦૦	– ઘસારો ૨૦,૦૦૦	૪,૮૦,૦૦૦
અનામત અને વધારો	૧,૨૮,૦૦૦	ફર્નિચર ૨૫,૬૦૦	
ન.નુ. ખાતું	૩૨,૦૦૦	– ઘસારો ૧,૬૦૦	૨૪,૦૦૦
૧૫% ડિબેન્ચર	૧,૬૦,૦૦૦	૧૦% પ્રો. ફંડમાં રોકાણ	૪૦,૦૦૦
પ્રો. ફંડ	૪૦,૦૦૦	૧૨% ડિબેન્ચરમાં રોકાણ	
લેણદારો	૩૨,૦૦૦	(મૂ.કિ. ૪૮,૦૦૦ અને	
દેવીહૂંડી	૧૪,૦૦૦	વ્યાજ કરવેરા)	૪૫,૬૦૦
		સ્ટોક	૩૨,૦૦૦
		દેવાદારો ૨૪,૦૦૦	
		– ધા. અનામત ૧,૬૦૦	૨૨,૪૦૦
		રોકડ અને બેંક	૧૧,૬૦૦
	૧૨,૦૬,૦૦૦		૧૨,૦૬,૦૦૦

વધારાની માહિતી :

- (૧) જમીન-મકાનની બજાર કિંમત ૫,૬૯,૬૦૦ છે.
- (૨) કંપનીનો સરેરાશ વાર્ષિક નફો (કર પહેલાનો ૫૦%) ૨,૨૪,૦૦૦ છે.
- (૩) રોકાયેલ મૂડી પર વળતર અપેક્ષિત ૧૦% છે.
- (૪) કંપનીની પાઘડી ૬૦,૮૦૦ નક્કી કરેલ છે.

કંપનીની શેરમૂડીની વાજબી કિંમત નક્કી કરો.

અથવા

- ૩ (અ) અતિમૂડીકરણ અને અલ્પ મૂડીકરણ વચ્ચે તફાવત.
- (બ) નાણાકીય લિવરેજ અને કાર્યકારી લિવરેજ વચ્ચેનો તફાવત.
- ૪ (અ) એકનોંધી અને દ્વિનોંધી વચ્ચે તફાવત.
- (બ) શેર મૂલ્યાંકનને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો.

અથવા

- ૪ (અ) પોર્ટફોલિયો સંચાલનનો અર્થ સમજાવો. રોકાણના નિર્ણયને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો.
- (બ) રોકાણોના પ્રકાર.

૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)

- (અ) પાણીયુક્ત મૂડી
- (બ) મૂડીકરણનું મહત્ત્વ
- (ક) લિવરેજનું મહત્ત્વ
- (ડ) પોર્ટફોલિયો સંચાલનના હેતુઓ.

ENGLISH VERSION

- 1 Mr. Somnath is a retail traders. He doesn't keep regular books of accounts. He paid expenses of business and others from the cash sales he earned. He always keeps amount of 2000 as cash on hand and rest of amount credits in bank account. The stock statement for the year ending on 30-6-2003 are lost. He always sells the goods to receive a profit of $33\frac{1}{3}\%$ on cost. Prepare final accounts for the year ended 30-6-2003 from the following information.

Assets and Liabilities	1-7-2004	30-6-2005
Cash Balance	2,000	2,000
Creditors	12,000	27,000
Bank Balance	No information	24,000
Debtors	30,000	1,05,000
Stock	84,000	No information

Following information is derived from the bank pass book :

Paid to creditors	2,10,000
Paid to business expenses	36,000
10% loan as on 1-1-05	30,000
Cash credit to bank	30,000
Receive from debtors	2,25,000

Moreover he paid in cash 6,000 to creditors to materials and paid in cash 12,000 for salary. He withdrew 24,000 for personal use.

OR

- 1 Prepare statement to be attached with the accounts according to section 212 of Indian Company Act.

- 2 On 1-1-2003 Shri Vipul had 12% Government Security having face value of Rs. 1,50,000 and book value of Rs. 1,44,000. Interest is paid on 31-3 and 30-9 every year on this security. Brokerage is calculated 1% on face value of every purchase-sale transactions.

Date	Face Value	Rate	Remarks
1-4-2003	80,000	99	Cum. Int. purchase
31-5-2003	60,000	101	Cum. Int. sale
1-6-2003	40,000	96	Ex. Int. sale
30-11-2003	20,000	98	Cum. Int. purchase

Valuation of closing stock is done as per LIFO method. Prepare 12% Government Security Accounts in the books of Shri Vipul for the year 2003.

OR

- 2 The balance-sheet of Deep Ltd. was as follows :

Balance Sheet as on 31-3-2011

Liabilities	Rs.	Assets	Rs.
Equity Share Capital (each share of Rs. 10)	1,80,000	Goodwill	10,000
Reserve and Surplus	20,000	Plant	1,20,000
Creditors	50,000	Furniture	5,000
Bills Payable	20,000	Stock	80,000
Expenses Outstanding	5,000	Debtors	40,000
		Prepaid expenses	3,000
		Cash and Bank	17,000
	2,75,000		2,75,000

The assets were valued as follow :

Plant..... 1,10,000

Stock..... 87,000

Furniture 6,000

Debtors 36,000

Last three years profit 30,000, 31,000 and 33,000

Return on capital invested is 10%.

Goodwill on the basis of three years purchase on the basis of the weighted average profit.

3 The following is the balance sheet of Krishna Ltd. as on 31-3-2011.

Liabilities	Rs.	Assets	Rs.
40,000 10% Pref. of share of Rs. 10 each	4,00,000	Goodwill	30,400
40,000 equity share of Rs. 10 each	4,00,000	Land and Buildings 5,40,000	
Reserves and Surplus	1,28,000	– Dep. 20,000	5,20,000
P & L Account	32,000	Machinery 5,00,000	
15% Debentures	1,60,000	– Dep. 20,000	4,80,000
Provident Fund	40,000	Furniture 25,600	
Creditors	32,000	– Dep. 1,600	24,000
Bills Payable	14,000	10% Investment P.F.	40,000
		12% Investment in Debentures (Face value 48,000 and Interest is taxable)	45,600
		Stock	32,000
		Debtors 24,000	
		–B.D. Res. 1,600	22,400
		Cash and Bank	11,600
	12,06,000		12,06,000

Additional Information :

- (1) The present market value of Land and Building 5,69,600
- (2) The company's average annual profit (before deducting tax at 50%) is 2,24,000
- (3) The expected rate of return on capital employed in this type of business is considered to be 10%
- (4) The value of Goodwill of the company has been ascertained at 60,800.

From the above particulars, ascertain the fair value of equity of the company.

OR

- 3 (a) Difference between over capitalization and under capitalization.
- (b) Difference between Financial Leverage and Operating Leverage.
- 4 (a) The difference between single entry and double entry system.
- (b) The factors affecting share valuation.

OR

- 4 (a) Explain the meaning of portfolio management. Discuss the factors affecting investing decisions.
- (b) Types of investments.
- 5 Write short notes : (any two)
 - (a) Watered Capital
 - (b) Importance of Capitalization
 - (c) Importance of Leverage
 - (d) Objective of portfolio management.